

Ref: SIPL/2019-20/0096

14th February, 2020

To,
The Manager (Listing)
Corporate Relationship Dept.
BSE Limited
P J Tower,
Dalal Street,
Mumbai - 400 001

The Manager (Listing)
National Stock Exchange of India Limited
"Exchange Plaza",
Plot No C/1, G Block
BandraKurla Complex, Bandra (E)
Mumbai - 400 051

Company Code: 539346 (BSE)

NSE Symbol: SADBHIN (NSE)

Dear Sir / Madam,


Sub: Newspaper Publication- Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.


Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing copy of published Unaudited Financial Results (standalone & consolidated) for the quarter and nine months ended 31st December, 2019 published in The Economic Times, English edition and Gujarati edition, Ahmedabad on 14th February, 2020. The same has been made available on the Company's Website www.sadbhavinfra.co.in.

You are requested to take the same on record.

Thanking You,
Yours Faithfully,

For Sadbhav Infrastructure Project Limited


Hardik Modi
Company Secretary
Membership No. F9193



Encl: a.a

Sadbhav Infrastructure Project Limited

Regd Office: "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad – 380006

T : +91 79 26463384 F : +91 79 26400210 E : investor@sadbhavinfra.co.in Web: www.sadbhavinfra.co.in CIN: L45202GJ2007PLC049808



SADBHAV INFRASTRUCTURE PROJECT LIMITED

CIN : L45202GJ2007PLC049808

Regd office : "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad - 380006

Phone: 079 - 26463384, Fax: 079 - 26400210, Email: investor@sadbhavinfra.co.in, Web: www.sadbhavinfra.co.in

Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2019

(INR in Million except as stated otherwise)

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Unaudited			Unaudited		
		Quarter ending 31-12-2019	Nine Months ending 31-12-2019	Quarter ending 31-12-2018	Quarter ending 31-12-2019	Nine Months ending 31-12-2019	Quarter ending 31-12-2018
1	Total Income from operations (net)	545.01	1,643.07	797.65	5,075.85	18,931.65	9,245.84
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	(214.48)	(178.83)	366.48	(1,176.96)	(2,561.13)	(605.88)
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)	(228.81)	(252.55)	213.53	(1,176.96)	(2,561.13)	(71.31)
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items)	(214.65)	(177.54)	140.97	(1,185.53)	(2,578.98)	(284.08)
5	Total comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(214.65)	(177.54)	140.97	(1,185.53)	(2,578.98)	(284.08)
6	Paid up Equity Share Capital (Face value of INR 10 each)	3,522.25	3,522.25	3,522.25	3,522.25	3,522.25	3,522.25
7	Earnings Per Share (face value of INR 10/- each) (for continuing and discontinued operations)						
	Basic and Diluted	(0.61)	(0.50)	0.40	(3.32)	(7.21)	(0.80)

Notes :

- 1 The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com, www.nseindia.com and on the Company website www.sadbhavinfra.co.in.

For and on behalf of the Board of Directors of
Sadbhav Infrastructure Project Limited

Place : Ahmedabad
Date : February 12, 2020

Vasistha C. Patel
Managing Director (DIN: 00048324)

Now, the public in general is hereby informed that the Property would be sold by public auction on AS IS WHERE IS BASIS and AS IS WHAT IS BASIS on 16th March 2020 at 5:00 p.m., at Deutsche Bank AG, 637 Gulbai Tekra , Off C.G.Road, Opposite CII House, Opposite Dev Aadi Hotel, Ahmedabad, Gujarat-380006 by inviting bids in the sealed envelope as per the procedure and the terms and conditions stated below:

Detail description of the property

All that title and interest over the piece and parcel of property Prabhat House , Sanathal Circle, Vill Sanathal , Ta- Sanad, Ahmedabad , Gujarat and the building is lying situated and being whole that right title and interest Prabhat House besides Sanathal bridge, Sanathal built on land bearing block no. 863 R.S.No. 265/P/6 admeasuring to 259 sq mtrs or 309 sq. yards Mouje Sanathal Ta- Sanand, Ahmedabad (Commercial Building, G+2 Floors with basement)

Property Address	Reserve Price	Earnest Money Deposit
Prabhat House b/s Sanathal bridge, Sanathal, Ahmedabad- 382210	₹ 2,61,00,000/-	₹ 26,10,000/-

The particulars in respect of the Property have been stated to the best of the information and knowledge of the Bank, who shall however not be responsible for any error, misstatement or omission in the said particulars. The Tenderer(s) / Offerer(s) / Prospective Bidder/Purchaser(s) are therefore requested, in their own interest, to satisfy himself / themselves/ itself with regard to the Property before submitting the tenders. To the best of the Bank's knowledge, there are no encumbrances on the Property and Bank has the right of sale of Property in compliance with due process of law.

TERMS & CONDITIONS OF PUBLIC AUCTION :

- The property can be inspected on 19th February, 2020 between 11.00 am to 5.00 pm.
- The bids shall be submitted in a sealed envelope to the office of undersigned along with a Demand Draft /Pay Order of Rs. 26,10,000/- (Twenty Six Lakh Ten Thousand Only) towards the Earnest Money Deposit ("EMD") favoring "M/s. Deutsche Bank EMD" so as to reach the office of Deutsche Bank AG at, 637 Gulbai Tekra , Off C.G.Road, Opposite CII House, Opposite Dev Aadi Hotel, Ahmedabad, Gujarat-380006, on or before 16th March 2020 by 2 pm.
- Offers that are not duly filled up or offers unaccompanied by the EMD or received after the date and time prescribed herein will not be considered / treated as valid offers, and accordingly shall be rejected. No interest shall be payable on the EMD.
- Along with bid form the proposed bidder shall also attach his/her identity proof, proof of residence (such as copy of the passport, election commission card, ration card driving license etc.) and a copy of the PAN card issued by the Income Tax department.
- The Property would not be sold below the reserve price.
- On the date of sale, all the bids duly received would be opened and the bid of the highest bidder, provided it is above the reserve price, may be accepted by the Bank. However the bidders personally present at the auction site shall have the right to further enhance their bid price, subject to a minimum of Rs 25,000/- (Rupees Twenty Five Thousand Only) over the price offered by the highest bidder and the Bank shall have the right to accept such higher bid. upon confirmation of the sale by the Bank , the purchaser will be required to pay deposit of 25% (twenty-five percent) of the sale price, after adjusting the earnest money deposit immediately with the undersigned.
- The request for extension of time may be allowed by the Bank at its sole discretion subject to such terms and conditions as may be deemed fit and proper by him. The balance amount of the purchase price shall be paid by the purchaser to the Bank on or before the fifteenth day after confirmation of the sale of the Property or such extended period as may be agreed upon in writing by the parties. In default of payment of entire consideration within the stipulated time, the Bank shall be at liberty to forfeit the EMD and/or any other payment made by the purchaser and proceed with re-auction of the Property. The defaulting purchaser shall forfeit all claims to the Property or to any part of the sum for which it may be subsequently sold.
- All payments shall be made by the purchaser by means of the Demand Draft/Pay Order favoring "Deutsche Bank EMD".
- On receipt of the sale price in full, the Bank shall issue a Sale Certificate in favour of the Purchaser/his nominee and would handover the possession of the Property to the purchaser.
- The Property shall vest in the Purchaser in all respects all risks related to the Property viz loss or damage by fire or theft or other accidents from the date of the confirmation of the sale by the Bank. The purchaser shall not be entitled to annul the sale on any ground whatsoever.
- The Demand Draft/Pay Order deposited towards the EMD shall be returned to the unsuccessful bidders.
- All expenses relating to Stamp Duty, Registration Charges, Transfer Charges and any other charges in respect of the Property shall be borne by the purchaser. All outgoing, i.e., Municipal Taxes, Maintenance / Society Charges, Electricity and water taxes, cess or any other dues including over dues in respect of the Property shall be paid by the successful purchaser.
- The Bank is not bound to accept the highest offer or any or all offers and the Bank reserves its right to reject any or all bid(s) without assigning any reasons.
- No person other than the bidders themselves or their duly authorised representative shall be allowed to participate in the sale proceedings.
- In case all the dues together with all costs, charges and expenses incurred by the Bank are tendered by the above named Borrower at any time before the date fixed for sale of the property under Sec 13(8) of the Act, then the Property will not be sold and all the bids received from the prospective bidders shall be returned to them without any liability/claim against the Bank.

This Notice is also notice to the abovesaid Borrower under Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

DATE - 14.02.2020
PLACE - Ahmedabad
Contact Numbers : 079-71015028 / 9712995845

Sd/-
Saurabh Shah
Authorized Officer- Deutsche Bank AG

રૂપિયો સ્થિર, સોનામાં મજબૂતાઈ જળવાઈ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં મજબૂતીને કારણે સ્થાનિક બજારમાં સોનું સુધારો દર્શાવી રહ્યું હતું. અમદાવાદ ખાતે સોનું પ્રતિ ૧૦ ગ્રામે ₹૨૦૦નો સુધારો દર્શાવી રહ્યું હતું. સ્ટાન્ડર્ડ સોનું(૯૯.૯ ટકા શુદ્ધતા)નો ભાવ ₹૪૨૦૦૦ હતો. જ્યારે દાગીના બનાવટમાં વપરાતું ૨૨ કેરેટ સોનું ₹૪૧૮૫૦ના સ્તરે હતું. વૈશ્વિક બજારમાં સોનું ૧૫૭૮ ડોલર પ્રતિ ટ્રોય ઓંસ પર અગાઉના બંધથી ૪ ડોલરની મજબૂતી દર્શાવી રહ્યું હતું. સ્થાનિક ચલણ રૂપિયામાં યુએસ ડોલર સામે સ્થિરતા જળવાઈ હતી અને તેને કારણે સોનાના ભાવ પર તેની કોઈ અસર જોવા મળી નહોતી. રૂપિયો ગ્રીનબેક સામે ૭૧.૩૩ના સ્તરે બંધ રહ્યો હતો. ફૂડના ભાવમાં સાધારણ મજબૂતીની રૂપિયાના મૂલ્ય પર કોઈ અસર થઈ નહોતી. અંતિમ બે ટ્રેડિંગ સત્રો દરમિયાન પોઝીટીવ બંધ રહેલું ફૂડ ગુરુવારે પ્રોષો ટકો થટાડો દર્શાવતું હતું. બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ ૫૫.૩૮ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે તેના તાજેતરના વાર્ષિક તળિયાથી મામૂલી સુધારો દર્શાવે છે. ચીન ખાતે કોરોના વાઈરસનો ઉપદ્રવ હજુ અંકુશમાં નથી આવ્યો અને બુધવારે તો ૨૦૦થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા હતાં. તેમજ ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યામાં ૧૫૦૦૦ની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. જેની પાછળ ઈક્વિટીઝ સહિત કોમોડિટીઝમાં સેન્ટિમેન્ટ ઓર ખરડાયું હતું.

રિયલમીનો એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન રિયલમી C3 લોચ

અમદાવાદ: સ્માર્ટફોન ઉત્પાદક રિયલમીએ તેના નવા ફોન રિયલમી C3ના લોચની જાહેરાત કરી છે. ₹૮૦૦૦ રૂપિયાથી ઓછા મૂલ્યમાં વધુ ક્વિયર્સ આપતો એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન ગુજરાત સહિત મોટા શહેરોમાં લોચ થયો છે. C3 એ રિયલમીની ઓલરાઉન્ડર સિરીઝના સ્માર્ટફોનની શ્રેણીમાં નવું ઉત્પાદન છે. ફુનિક્શન


૧૦.૨ મિલિયન યૂઝર્સ તેનો ઉપયોગ કરી ચૂક્યા છે અને તેણે ભારતમાં સ્માર્ટફોનના એન્ટ્રી લેવલ સેગમેન્ટને નવી પરિભાષા આપી છે. રિયલમી C3ના વાઈસ પ્રેસિડન્ટ માધવ શેઠે જણાવ્યું હતું કે, “ભારતમાં અમે એન્ટરટેઈનમેન્ટના સુપરસ્ટાર રિયલમી C3ને લોચ કરીએ છે, તેમાં પાવર અને સ્ટાઈલનું મિશ્રણ

છે. અમારા એન્ટ્રી લેવલ C સિરીઝના સ્માર્ટફોનને યૂઝર્સનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે રિયલમી C3 આ યાત્રાને જાળવી રાખશે. વર્ષ ૨૦૧૮માં ૩ ટકાના બજાર હિસ્સાથી ૨૦૧૯માં ૧૦ ટકાના બજાર હિસ્સા સુધી અમે પાછલા એક વર્ષમાં ૨૫૫ ટકાથી વધુની વૃદ્ધિ કરી છે.

અદાણી ટ્રાન્સમિશને \$2.6 અબજ રિફાઈનાન્સ કર્યું

નવી દિલ્હી: અદાણીએ તાજેતરમાં જ ૨.૬ અબજ ડોલરનું રિફાઈનાન્સિંગ ડીલ કર્યું છે. કંપની તેના વર્તમાન પ્રોજેક્ટમાં ડિલિવરેજિંગ પર નજર માંડી

રહી છે અને એક વખત તે પૂરા થશે, પછી તેમા આ કાર્યવાહી કરાશે. છેલ્લા કેટલાક માસમાં ગૌતમ અદાણીની ₹૧૮,૦૦૦ કરોડનો જંગી બોજ ધરાવતી કંપનીએ ૨.૬ અબજ ડોલરનું કેપિટલ મેનેજમેન્ટ તાજેતરમાં પૂરું કર્યું છે. તેમા કતાર ઓથોરિટીને ૨૫.૧ ટકા હિસ્સા વેચાણનો સમાવેશ થાય છે.



SADBHAV INFRASTRUCTURE PROJECT LIMITED

CIN : L45202GJ2007PLC049808
 Regd office : "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad - 380006
 Phone: 079 - 26463384, Fax: 079 - 26400210, Email: investor@sadbhavinfra.co.in, Web: www.sadbhavinfra.co.in

Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2019

Sr. No.	Particulars	Standalone (INR in Million except as stated otherwise)					
		Unaudited			Consolidated		
		Quarter ending 31-12-2019	Nine Months ending 31-12-2019	Quarter ending 31-12-2018	Quarter ending 31-12-2019	Nine Months ending 31-12-2019	Quarter ending 31-12-2018
1	Total Income from operations (net)	545.01	1,643.07	797.65	5,075.85	18,931.65	9,245.84
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	(214.48)	(178.83)	366.48	(1,176.96)	(2,561.13)	(605.88)
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)	(228.81)	(252.55)	213.53	(1,176.96)	(2,561.13)	(71.31)
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items)	(214.65)	(177.54)	140.97	(1,185.53)	(2,578.98)	(284.08)
5	Total comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(214.65)	(177.54)	140.97	(1,185.53)	(2,578.98)	(284.08)
6	Paid up Equity Share Capital (Face value of INR 10 each)	3,522.25	3,522.25	3,522.25	3,522.25	3,522.25	3,522.25
7	Earnings Per Share (face value of INR 10/- each) (for continuing and discontinued operations)	(0.61)	(0.50)				
	Basic and Diluted			0.40	(3.32)	(7.21)	(0.80)


The above is an extract of the detailed format of Financial and Board of Unaudited Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities Exchange and Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited financial results is available on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com, www.nseindia.com and on the Company website www.sadbhavinfra.co.in.

For and on behalf of the Board of Directors of
Sadbhav Infrastructure Project Limited
Vasistha C. Patel
 Managing Director (DIN: 00048324)

Place : Ahmedabad 2020
 Date : February 12,

જાહેર નિવેદન નં. ૧૩ સને ૨૦૧૯ - ૨૦			
નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી શહેર (માત્રમ) પેટા વિભાગ, ૩/બી બહુમાળી ભવન, વસ્ત્રાપુર સરકારી વસાહત પાસે, ગ્રાઈવ ઈન રોડ, ગુરૂકુળ પાસે, અમદાવાદ-૫૨ ફોન નં. ૦૭૯-૨૭૯૧૦૪૫૩ની કચેરીએથી સીલબંધ ટેન્ડરો અંદાજીત રૂ. ૧.૦૦ લાખ સુધીના સીવીલ વર્કસના ૨ (બે) કામ માટે રજી.પો.એ.ડી./સ્પીડ પોસ્ટથી માંગવામાં આવે છે. કોરા ટેન્ડરો સાંજના ૪:૦૦ વાગ્યા સુધી નીચે મુજબની તારીખે આપવામાં આવશે. જેની વિગતવાર માહિતી તેમજ તેની શરતો અને નીચેની કચેરીના નોટીસ બોર્ડ ઉપર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂમાં સંપર્ક કરવાથી જોવા મળશે.			
કોઈપણ એક અથવા બધા ટેન્ડરો કોઈ પણ જાતના કારણો આપ્યા વિના રદબાતલ કરવાના સર્વે હક્ક નાયબ કાર્યપાલક ઈજનેરને આપિન રહેશે.			
અનું.	કોરા ભાવખંડો કયા પ્રકારની ઓજન્સીઓને ઇસ્યુ કરવા	કોરા ભાવખંડો આપવાની તારીખે ઉલ્લી ૩.	શક્ય હશે તો આવેલ ટેન્ડરો ૧૩:૦૦ કલાકે પોલવાની તારીખ ૫.
૧.	૨.	૨૬.૦૨.૨૦	૨૬.૦૨.૨૦
૧	માન્ય ઈજારદાર શ્રીઓ માટે	૧૯.૦૨.૨૦	૧૬.૦૦ કલાક સુધી

ક્રમાંક/સંખ્યા/અમદ/૧૭૯૪/૨૦૨૦-૨૧



કેનરા બેંક

(ભારત સરકારનું ઉપક્રમ)

કલમ ૧૩(૪) કલમ ૧૩(૪)

(સ્થાવર મિલકત માટે)

આથી, કેનરા બેંક, ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન એન્ડ સિક્યુરિટીઝ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઓટોમોટીવ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (૨૦૦૨નો એક્ટ ૫૪) (હવે પછીથી કાયદા કરીકે નિર્દિષ્ટ) અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) અક્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૧૨)ના ગિયમ ૩ સહિત વંચાણે લેતાં મળેલ સત્તાની રૂએ તા.૧૧-૧૦-૨૦૧૯ ના રોજ માંગણા નોટિસ પાઠવી હતી અને તા.૦૯-૧૧-૨૦૧૯ના રોજ પેપર પબ્લિકેશન કરેલ હતું જે અનુસાર બેંકના પ્રધાનશ્રી નવિનકુમાર છગનલાલ સોની અને શ્રીમતિ સોનલબેન નવિનકુમાર સોનીને નોટિસમાં જણાવ્યા મુજબ એકાઉન્ટ નં.૩૭૭૮૬૧૮૦૦૦૦૧ અને ૩૨૭૮૬૧૮૦૦૦૦૩ માટે બેંકના લેણાંની રકમ રૂ.૧૩,૩૦,૭૪૨-૫૦ (રૂપિયા ત્રે લાખ ત્રીસ હજાર સાતસો ભેતાવીસ અને પચાસ પચાસ પૂરા) વત્તા તેની પર ચડતું વ્યાજ વગેરે આ નોટિસ મળ્યાથી ૬૦ દિવસની અંદર ચૂકવવા માટે જણાવેલ છે.

દેવાદાર બેંકની લેણી રકમ પરત કરવામાં નિષ્ફળ જવાથી ખાસ દેવાદાર અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ મિલકતનો તેમને સંદેહ કાયદાની કલમ ૧૩(૪), રૂલ નં.૮ અને ૯ સાથે વંચાણે લેતાં મળેલ સત્તાની અંદર નીચે દર્શાવેલ મિલકતનો તારીખ ૧૨-૦૨-૨૦૨૦ના રોજ કલમ ૧૩(૪)ની લીધેલ છે.

દેવાદારને ખાસ અને જાહેર જનતાને સામાન્યતઃ ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકત સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અથવા કોઈપણ પ્રકારનો વ્યવહાર તે મિલકત અંગેનો કેનરા બેંકના રૂ.૧૩,૩૦,૭૪૨-૫૦ અને તેના પરનું વ્યાજ વગેરેના બોજને આધીન રહેશે.

દેવાદારને સંરક્ષેથી એક્ટની સેક્શન ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઈઓ અનુસાર સુરક્ષિત મિલકતનો બચાવવા માટે પ્રાપ્ય થતા સમય અંગે ધ્યાન દોરવામાં નિષ્કલ્પનો તમામ ભાગ અને હિસ્સો-ફલેટ નં./પ્લોટ નં.૨૨૦, વાસુદેવ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, સુભાષ રોડ, ૩૦-૯ પેકો, ભોલાવ, આવેલ છે, કે જેની નીચે મુજબ છે:

દક્ષિણ : પ્લોટ નં. ૨૧૬, પૂર્વ : પ્લોટ નં. ૨૦૬, ભરુચ, ગુજરાતમાં રોડ. ચતુ:સીમા ઉત્તર : પુલ્લી જમીન ન પશ્ચિમ : ૮.૫૦ મીટર તારીખ : ૧૨-૦૨-૨૦૨૦ અધિકૃત અધિકારી કેનરા બેંક